

- ❖ તાલુકાઓ :- ૬ (૧) જામનગર (૨) લાલપુર (૩) કાલાવડ (૪) જામજોધપુર (૫) ધ્રોળ (૬) જોડિયા
- ❖ જામનગર મહાનગર પાલિકાની કુલ વોર્ડ અને સીટો :- ૧૬ બેઠકો (૬૪ સભ્યો) (ભાજપ-૩૮, કોંગ્રેસ-૨૪, અન્ય-૨)
- ❖ જામનગરના મેયર :-
- ❖ જામનગરના ડેપ્યુટી મેયર :-
- ❖ તાલુકા પંચાયતની કુલ સીટો અને બેઠકો :- ૬ (બેઠકો- ૧૧૨) (કોંગ્રેસ-૬ (૮૪) , ભાજપ-૦(૨૮))
(જામનગર-૨૬, લાલપુર-૧૮, જોડિયા-૧૬, ધ્રોળ-૧૬, જામજોધપુર-૧૮, કાલાવાડ-૧૮)
- ❖ જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૪ (કોંગ્રેસ- ૧૭ , ભાજપ-૭)
- ❖ જિલ્લા પંચાયત પ્રમુખ :- મૂળજીભાઈ વાઘેલા
- ❖ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- જયેન્દ્રભાઈ મુંગરા
- ❖ આરટીઓ નંબર :-GJ -10
- ❖ નદીઓ :- કુલઝર, ભોગત, નાગમતી, રંગમતી, ઊંડ, ઘી, સિંહણ, સાની, રૂપારેલ, સસાઈ
- ❖ તળાવ અને સરોવર :-લખોટા તળાવ અને રણમલ તળાવ (જામનગર), રણજીત સાગર (જામનગર)
- ❖ સિંચાઈ યોજનાઓ :- રણજીત સાગર બંધ (નાગમતી), ઉંડ બંધ (ઉંડ)
- ❖ અભયારણ્ય :-સામુદ્રિક જીવસૃષ્ટી અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય
- ❖ નેશનલ પાર્ક :- મરીન નેશનલ પાર્ક, પિરોટન (દરિયાઈ જીવો)
- ❖ ડેરી ઉદ્યોગ :- જામનગર ડેરી
- ❖ બંદરો :- ઓખા, બેડી, સિક્કા, સલાયા, વાડીનાર, રૂપેણ, જોડીયા, દ્વારકા અને સયાણા
- ❖ પર્વતો :- સતિયાદેવ, વેણુ, ગોપની ટેકરીઓ, બરડો
- ❖ હવાઈ મથક :- જામનગર
- ❖ ઉદ્યોગો:- સિમેન્ટ, ચંત્ર, ચિનાઈ માટીના વાસણો, દવા, રસાયણો, સુતરાઉ કાપડ, ગરમ કાપડ, મીઠું, કાગળ, મત્સ્ય ઉદ્યોગ, જહાજ ભાંગવાનો ઉદ્યોગ અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરૂ થયો છે. સૂડીયપ્પા ગૃહ ઉદ્યોગ પણ વિકસ્યો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે
- ❖ મુખ્ય પાકો :- બાજરી, મગફળી, લસણ, કપાસ, જુવાર, બટાકા, ઘઉં, ચીકોરી, ડુંગળી
- ❖ ખનીજ :- ચૂનો, ચિનાઈ માટી, બોક્સાઈટ, ચિરોડી, સૌથી વધુ બોક્સાઈટ અને ચિરોડી (જિપ્સમ) મળી આવે છે.

❖ શૈક્ષણિક સંસ્થાઓ :-

- ⇒ ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી, જામનગર
- ⇒ સરકારી મેડીકલ, કોલેજ , જામનગર
- ⇒ મીલેત રીસર્ચ સ્ટેશન, જામનગર

- ❖ જોવાલાયક સ્થળો:-દ્વારકા, નાગેશ્વર, લાખોટા પેલેસ, પ્રતાપવિલાસ મહેલ, સોલેરીયમ મુક્તિધામ, સોડાએશનું કારખાનું(મીઠાપુર), સિમેન્ટની ફેક્ટરી(સિક્કા) સૌર ચિકિત્સાલય , ભીડભંજન મહાદેવ,(જામનગર), બેટ દ્વારકા, ધુમલી, ખીજડીયા પક્ષી અભ્યારણ, નકલંગ રણજા, પિરોટન ટાપુ, હરસિક્ક મંદિર.

વિશેષ નોંધ :

- ❖ રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી આવેલી છે.
- ❖ મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો 'નવાનગર' ના નામે જાણીતો હતો.
- ❖ જામ રણજીતસિંહજીની યાદમાં જ આજે ભારતમાં ક્રિકેટની રમતમાં ' રણજી ટ્રોફી' રમાય છે.
- ❖ "સૌરાષ્ટ્રનું પેરિસ"એ જામનગર ગણાય છે.
- ❖ સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો જામનગર છે.
- ❖ જામનગર એ ધાર્મિક નગરી ગણાય છે.અહીંના બ્રાહ્મણો ખુબ વિદ્વાન હતા.
- ❖ દેશની પ્રથમ અને ગુજરાતની એક માત્ર આર્યુવેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે.(સ્થાપના-૧૯૬૭)
- ❖ જામનગર કંકુ,મેશ અને બાંધણી દેશભરમાં સુપ્રસિદ્ધ છે,
- ❖ જામનગરમાં સ્મશાન ગૃહ, સર્કિટ હાઉસ, રાજમહેલ, લખોટા તળાવ જોવાલાયક છે.
- ❖ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પણ જામનગરની ઉત્તરે કચ્છના અખાતમાં આલમ છે.
- ❖ જામનગરમાં પરવાળાના ટાપુઓ આવેલા છે. જેમાં 42 જેટલા નાના મોટા પરવાળા બેટ છે.
- ❖ શ્રીકૃષ્ણ રાજધાની અને જગતગુરુ શંકરાચાર્યે સ્થાપેલા ચાર આશ્રમો પૈકી શારદાપીઠ એક આશ્રમ છે
- ❖ પોરબંદર જવાના માર્ગ પર પ્રખ્યાત હરસિક્ક માતાનું મંદિર આવેલું છે.
- ❖ મીઠાપુરમાં તાતાની સોડાએશનની વિશાળ ફેક્ટરી છે.
- ❖ જામનગર એ બ્રાસપાર્ટના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
- ❖ સચાણા જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે.
- ❖ પિત્તળની હાથકારીગરીની બનાવટો માટે જામનગર જાણીતું છે.

- ❖ બાલાછડીમાં ભૂમિદળ ' સૈનિકશાળા'ની સ્થાપના કરવામાં આવી છે. તથા વાવસુરામાં નૌકાસેના તાલીમશાળા આવેલી છે.
- ❖ બેડીબંદરમાં નૌસેના અને વાયુસેનાનું થાણું છે.
- ❖ ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ લાંબામાં આવેલ છે.
- ❖ જામનગરમાં સિક્કા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે.

gnanbhandar.com